



COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં થેન્ક્સગિવિંગ 2020

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 6, 2020) – આ વર્ષે, થેન્ક્સગિવિંગ સોમવાર, ઓક્ટોબર 12 નાં રોજ યોજાશે.

અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ નિર્ણાયક સેવાઓનું સંચાલન સમુદાયને ટેકો આપવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા (બ્રેમ્પટન બહારથી) 905.874.2000 નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે કે ઈમેઈલ સરનામું 311@brampton.ca પર ઈમેઈલ મોકલી શકે છે. માર્સ્ક પહેરવો અથવા માત્ર એપોઈન્ટમેન્ટ લઈને પસંદગીની સીટીની સગવડો સુરક્ષિતપણે ફરીથી ખોલવી જેવી COVID-19 ને સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલની કોઈપણ બાબતો માટે અમે 24/7 ઉપલબ્ધ હોઈએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 જુઓ.

આતશબાજી સુરક્ષા (ફાયરવર્ક્સ સેફ્ટી)

સીટી ઓફ બ્રેમ્પટન થેન્ક્સગિવિંગ પર કોઈ આતશબાજી પ્રદર્શન કરશે નહિ અને અંગત ધોરણે આતશબાજી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

થેન્ક્સગિવિંગ વર્ષ દરમિયાનના એ ચાર દિવસો પૈકી એક નથી કે જ્યારે સીટી ઓફ બ્રેમ્પટનમાં અંગત આતશબાજી કરવાની છૂટ આપવામાં આવતી હોય. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/bylaws.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

થેન્ક્સગિવિંગ સોમવાર પર બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે પણ કેટલાક રૂટ્સ રદ કરવામાં આવશે. કૃપા કરી પ્રવાસ કરતા પહેલાં સમયપત્રકો તપાસો.

ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી 905.874.2999 નંબર પર ચાલુ અને ઉપલબ્ધ છે.

કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ છે અને બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના કલાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બંધ રહે છે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 કલાકે તમામ સાખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સાખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માર્સ્ક પહેર્યો હોય તો પણ, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, તમારાથી સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.



પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર તમારું નાક, મોઢું અને હડપચી (દાઢી) ઢાંકતા નોન-મેડિકલ મારક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અઘતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

બ્રેમ્પટન રિક્રિએશન

રિક્રિએશન સેન્ટર્સ થેન્ક્સગિવિંગ પર બંધ રહેશે જેમાં પસંદગીના સ્થળો મંગળવાર, ઓક્ટોબર 13 થી એપોઈન્ટમેન્ટ લઈને મુલાકાત માટે ફરીથી ખુલશે. બંધાં મનોરંજન કાર્યક્રમો અને સેવાઓ પર વધુ માહિતી માટે, જગ્યા કેવી રીતે આરક્ષિત કરાવવી તે સહિત, આ વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ.

ઘરે હો તે વખતે ઓનલાઈન શિક્ષણ લઈને સક્રિય અને પ્રવૃત્તમય રહેવાનું ચાલુ રાખો. સંપૂર્ણ બોડી સરકિટ અજમાવી જુઓ, ઓરિગામી હાટ્સ બનાવતા શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બંધાંનો મહાવરો કરો! રેક એટ હોમ (Rec At Home) પ્રવૃત્તિઓ અહીં જુઓ, www.brampton.ca/recathome.

ફોલ (પાનખર ઋતુ) માટે બ્રેમ્પટનના પાર્ક્સની સફાઈ

આપણી પાનખરની સફાઈના ભાગરૂપે આપણાં શહેરમાં - તમારા ઘરની આસપાસ, સ્થાનિક પાર્ક, કે તમારા ધંધાની આગળ ગંદવાડો સાફ કરવામાં મદદરૂપ થવા થોડીક મિનિટો વિતાવો. તમે મફત કિલનઅપ કિટ મેળવવા ઓનલાઈન નોંધણી અહીં કરાવી શકો છો, www.brampton.ca/cleanup. એક બ્રેમ્પટનવાસી હરિયાળો પ્રભાવ પાડવા કેવી રીતે અગ્રેસર રહે છે તે વિશે વધુ જાણવા અમારી ઓનલાઈન ઝુંબેશ "Be like Bill" (બિલની જેમ બનો) ચોક્કસપણે તપાસો.

બ્રેમ્પટન લાઈબ્રેરી

સોમવાર, ઓક્ટોબર 12 નાં રોજ બ્રેમ્પટન લાઈબ્રેરીની શાખાઓ બંધ રહેશે અને કર્બસાઈડ પિકઅપ ઉપલબ્ધ થશે નહીં. [ડિજિટલ લાઈબ્રેરી](#)માં મફત eBooks (ઈ-બુક્સ) અને eAudiobooks (ઈ-ઓડિયોબુક્સ), એન્ટરટેઈનમેન્ટ સ્ટ્રીમિંગ, ઓનલાઈન શિક્ષણ અને ઘણું બધું તમને કોઈ ખર્ચ વગર તમારા બ્રેમ્પટન લાઈબ્રેરી કાર્ડ નંબર અને PIN (પિન) વડે શોધી કાઢો. [અહીં કિલક કરો એક ઓનલાઈન લાઈબ્રેરી કાર્ડ મેળવવા](#) અથવા તમારા એકાઉન્ટમાં સહાયતા માટે. બંધી ઉંમરના લોકો માટેના વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સમાં સહભાગી થાવ અને સંપર્કમાં રહેવા [બ્રેમ્પટન લાઈબ્રેરીની ઈમેઈલ અપડેટ્સ સબસ્ક્રાઈબ કરો](#). અમારી સાથે Facebook, Twitter અને Instagram પર [@bramptonlibrary](https://twitter.com/bramptonlibrary) મારફતે જોડાઓ.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર થેન્ક્સગિવિંગ પર બંધ રહેશે.

એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર કાર્યરત હોય છે, અને તેઓમાત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:



- માંદા/ઈજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવા
- મરેલું પ્રાણી લઈ જવા

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

થેન્ક્સગિવિંગ વીકએન્ડ માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ

તમારું સામાજિક વર્તુળ ઘટાડો

COVID-19 નું જોખમ ઘટાડવાના હેતુસર, આપણને સૌને અન્ય લોકો સાથે આપણો સંપર્ક ઘટાડવાની જરૂર છે. પીલ પબ્લિક હેલ્થ લોકો સાથેનો મેળાવડો નાની સંખ્યામાં રાખવાની, અને તમારું સામાજિક વર્તુળ તમારા ત્વરિત ઘરબારના કે અનિવાર્ય સંભાળકર્તાઓ સુધી ઘટાડવાની ભલામણ કરે છે.

ફેલાવાનું જોખમ ઘટાડો

આ વર્ષે થેન્ક્સગિવિંગ જુદું જણાશે. આપણે સાથે મળીને આભાર માનીએ છીએ ત્યારે, એ મહત્વપૂર્ણ છે કે આપણાં પ્રિયજનોને COVID-19 નાં જોખમ સામે સંરક્ષણ આપતી પસંદગીઓ કરીએ. ફેલાવાનું જોખમ ઘટાડવા ઓછામાં ઓછું બે મીટરનું ભૌતિક અંતર જાળવો. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું શક્ય ના હોય ત્યાં, માસ્ક પહેરવાની ખાતરી કરો.

જો ક્યાંક લોકો ભેગા થવાના હોય તો, ઓછાં ભેગા થાવ તે વધારે સારું છે

યજમાનોએ મહેમાનોની સંખ્યા ત્વરિત ઘરબારના અને અનિવાર્ય સંભાળકર્તાઓ સુધી સીમિત રાખવી જોઈએ. મહામારી દરમિયાન ઓછી સંખ્યા એ વધારે બરાબર છે. જો તમે તમારા ત્વરિત ઘરબાર બહારના લોકો સાથે સંપર્ક કરવાનું પસંદ કરો તો, સંખ્યા સીમિત કરો, તમારો બધાંનો એકસાથે ભેગા થવાનો સમય ઘટાડો, એકબીજાથી દૂર રહો, માસ્ક્સ પહેરો અને હાથ ધુઓ. જો બીમાર હો તો, રૂબરૂમાં ભેગા થવાને બદલે વર્ચુઅલી (આભાસીય) ભેગા થાવ, પરીક્ષણ કરાવો અને ઘરે પોતાને અલગ (સેલ્ફ-આઈસોલેટ) કરો.

જો તમે બીમાર હો તો કોઈની સાથે ભેગા થશો નહીં

તમને થેન્ક્સગિવિંગમાં ભેગા થવાનું નિમંત્રણ મળ્યું છે પણ શું તમારી તબિયત સારી નથી? COVID-19 નું પીલમાં જોખમ ચાલુ છે ત્યારે આપણે એકબીજા સાથે ભેગા થઈએ ત્યારે, વર્ચુઅલી જોડાવાનું પસંદ કરો, ઘરે પોતાને અલગ (સેલ્ફ-આઈસોલેટ) કરો અને તંદુરસ્ત રહેવા પરીક્ષણ કરાવો.

આ થેન્ક્સગિવિંગ વીકએન્ડ પર પોતાને અને પ્રિયજનોને સુરક્ષિત રાખવાની રીત પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, peelregion.ca/coronavirus/ અથવા રીજીયન ઓફ પીલને ઓનલાઈન અનુસરો [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર.

-30-

रीज्यन ओफ़ पील मीडिया संपर्क

अश्ली हॉकिंस (Ashleigh Hawkins)

कम्युनिकेशन्स स्पेशियलिस्ट – ज़ादेर आरोग्य

रीज्यन ओफ़ पील

416.818.4421 | ashleigh.hawkins@peelregion.ca

सीटी ओफ़ ब्रैम्पटन मीडिया संपर्क

मोनिका दुग्गल (Monika Duggal)

कोर्डिनेटर, मीडिया अन्ड कम्युनिटी एन्गेजमेन्ट

स्ट्रेटेजिक कम्युनिकेशन

सीटी ओफ़ ब्रैम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca